



PROCEDURE FOR ADMISSION CONFIRMATION - ROUND 1 [એડમિશન કફર્મ કરવા માટેની પ્રક્રિયા – રાઉન્ડ 1]

DECLARATION OF RESULT OF SEAT ALLOTMENT AND PRINTING OF ALLOTMENT LETTER [બેઠકોની ફાળવણીના પરિણામની જાહેરાત અને એલોટમેન્ટ લેટરનું પ્રિન્ટીંગ]

- After choice filling ACPUGMEC will declare result as per the merit number and choices filled by the candidate [ચોઈસ ફીલિંગના પ્રક્રિયા બાદ ACPUGMEC ઉમેદવારના મેરિટ અને ચોઈસને ધ્યાનમાં રાખી બેઠકોની ફાળવણીના પરિણામની જાહેરાત કરશે.]
- Candidate can download his allotment letter and fees challan from his account after login with the help of User ID & Password [ઉમેદવાર યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગ-ઇન કર્યા પછી પોતાનો એલોટમેન્ટ લેટર અને ફીના ચલણ ડાઉનલોડ કરી શકશે].

PAYMENT OF FEES [ફીની ચૂકવણી]

- Candidate can pay the tuition fees of allotted college either by online payment mode through official website of ACPUGMEC or by cash/ Demand Draft through designated branch of bank (List of designated bank's branches is available on admission committee's website <http://medadmgujarat.org/ug/home.aspx>). [ઉમેદવારે કમિટી દ્વારા મંજૂર કરાયેલ બેન્કની શાખાઓમાં (મંજૂર કરાયેલ બેન્કની શાખાઓની યાદી પ્રવેશ સમિતિની વેબસાઇટ www.medadmgujarat.org પર ઉપલબ્ધ છે) ટ્યુશન ફી અથવા ટ્યુશન ફીનો તફાવત (જો ફી અગાઉના રાઉન્ડમાં ચૂકવવામાં આવી હોય તો) ઓનલાઇન પેમેન્ટ ગેટવે (વેબસાઇટ પર ઉપલબ્ધ) અથવા રોકડ રકમ અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ “ACPUGMEC”, payable at Gandhinagar દ્વારા જમા કરાવી શકશે.]
- After payment of tuition fees students has to collect receipt generated from ACPUGMEC portal in 2 copies and copy of challan (2 copies). [ટ્યુશન ફી જમા કરાવવા માટે ઉમેદવારે ફક્ત અધિકૃત બેંકની નિયુક્ત શાખા (વેબસાઇટ પર ઉપલબ્ધ યાદીની) ની મુલાકાત લેવી પડશે. ટ્યુશન ફીની ચૂકવણી પછી વિદ્યાર્થીઓએ ACPUGMEC પોર્ટલમાંથી બનાવેલી રસીદ 2 નકલોમાં અને ચલણની નકલ (2 નકલો) લેવાની રહેશે.]
- **For NRI Candidate:** The candidate who has been allotted seat in NRI category, he/she has to pay Rs. 5.00 lakh (as Refundable Deposit) by online payment gateway or cash or Demand Draft in favor of “ACPUGMEC” payable at Gandhinagar in the designated bank's branches approved by ACPUGMEC. After that students have to confirm the admission by submitting Original Documents Help Center. Then candidate has to pay prescribed tuition fees in US Dollar or equivalent amount in any other foreign currency on or before **9th December, 2020**. If any candidate fails to deposit this fee at admitted institute in stipulated timeframe, the admission will be considered as cancelled. ACPUGMEC will refund the deposit amount of Rs. 5.00 lakh after the completion of whole admission process. [એન.આર.આઈ. ઉમેદવાર માટે: એન.આર.આઈ. બેઠક પર પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ રૂ. ૫.૦૦ લાખ (રીફંડેબલ ડિપોઝીટ રૂપે) ઓનલાઇન પેમેન્ટ ગેટવે (વેબસાઇટ પર ઉપલબ્ધ) અથવા રોકડ રકમ અથવા ડીમાન્ડ ડ્રાફ્ટ “ACPUGMEC”, payable at Gandhinagar દ્વારા પ્રવેશ મેળવ્યા બાદ કમિટી દ્વારા નિયત કરેલ બેંકની શાખામાં ભરવાની રહેશે. ત્યારબાદ પ્રવેશ મેળવેલ સંસ્થા ખાતે નિયત કરેલ ફી અમેરિકન ડોલરમાં અથવા સમકક્ષ વિદેશી ચલણમાં



Admission Committee for Professional Undergraduate & Postgraduate Medical Educational Courses (ACPUGMEC & ACPPGMEC)

Constituted under the Gujarat Professional Medical Educational Institutions
(Regulation of Admission and Fixation of Fees) Act, 2007, Gujarat Act No. 3 of 2008

Government of Gujarat



ડિસેમ્બર ૦૯, ૨૦૨૦ સુધીમાં જમા કરાવવાની રહેશે. જો કોઈ ઉમેદવાર નિયત કરેલ સમયમર્યાદા માં ફી સંસ્થામાં જમા નહિ કરાવે તો પ્રવેશ રદ થયેલ ગણાશે. ડિપોઝીટ રૂપે જમા કરાવેલ રૂ. ૫.૦૦ લાખ ની રકમ સમગ્ર પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ રિફંડ તરીકે પરત આપવામાં આવશે.]

INSTRUCTIONS FOR ADMISSION CONFIRMATION [એડમિશન કન્ફર્મ કરવા માટેની સૂચનાઓ]

- **Candidate has to take prior appointment for the Document Submission at Help Center. Candidate can select the Date and Help Center for Document Submission at the time of printing the Allotment Letter. [ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે અગાઉથી અપોઇન્ટમેન્ટ લેવાની રહેશે ઉમેદવાર, પોતાની જાતે, એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે, અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટેની તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકશે.]**
- After payment of tuition fees, the candidates who have been allotted seat, they have to submit their original documents at appointed Help Centre as under [ત્યુશન ફીની ચુકવણી કર્યા બાદ, જે ઉમેદવારોને પ્રવેશ ફાળવેલ છે, તેવા તમામ ઉમેદવારોએ અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે નીચે મુજબ અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે]:
 1. Allotment Letter of ACPUGMEC [ACPUGMEC નો એલોટમેન્ટ લેટર]
 2. Receipt of Payment of Tuition Fee at Bank [બેન્કમાં ત્યુશન ફી જમા કરાવ્યાની અસલ રસીદ]
 3. Tuition Fee Receipt generated thru' Admission Module [એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ત્યુશન ફી જમા કરાવ્યાની રસીદ]
 4. Print Copy NEET-UG mark-sheet of current academic year [વર્તમાન શૈક્ષણિક વર્ષ ની NEET-UG માર્કશીટની પ્રિન્ટ]
 5. Std. 10th Marksheet [ધો. ૧૦ ની માર્કશીટ]
 6. Std. 12th Marksheet [ધો. ૧૨ ની માર્કશીટ]
 7. Document showing place of birth & Date of Birth & Indian Citizenship (School leaving Certificate/ Transfer Certificate/ Passport/ Birth Certificate) [જન્મ સ્થળ/ જન્મ તારીખ અને ભારતીય નાગરિકતાના પુરાવાનું પ્રમાણપત્ર (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/ ટ્રાન્સફર સર્ટિફિકેટ/ પાસપોર્ટ/ જન્મનું પ્રમાણપત્ર)]
 8. Domicile Certificate (with signature and stamp of Authority) issued by Competent Authorities (Mamlatdar / Executive Magistrate / Commissioner of Police) of Gujarat State only [ફક્ત ગુજરાત રાજ્ય ના અધિકારીઓ (મામલતદાર / એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/ પોલીસ કમિશનર) દ્વારા આપેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ (અધિકારીના સહી અને સિક્કા વાળું)]
 9. For SEBC, ST and SC Category: Caste certificate issued by Competent Authorities of Gujarat State only [એસ.ઈ.બી.સી., એસ.ટી. અને એસ.સી. કેટેગરી માટે: ફક્ત ગુજરાત રાજ્ય ના અધિકારીઓ દ્વારા આપેલ જાતિ પ્રમાણપત્ર]
 10. For SEBC Category: Non-creamy layer certificate (Parishistha '4' in Gujarati/English) issued by Competent Authorities of Gujarat State only [એસ.ઈ.બી.સી. કેટેગરી માટે: નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ ફક્ત ગુજરાત રાજ્ય ના અધિકારીઓ દ્વારા આપેલ પરિશિષ્ટ '૪' ગુજરાતી/અંગ્રેજી માં]
 11. For EWS (Economically Weaker Sections) Category: EWS certificate issued by Competent Authorities of Gujarat State only [EWS (આર્થિક રીતે નબળા વર્ગો) કેટેગરી માટે: EWS (આર્થિક રીતે નબળા



Admission Committee for Professional Undergraduate & Postgraduate Medical Educational Courses (ACPUGMEC & ACPPGMEC)

Constituted under the Gujarat Professional Medical Educational Institutions
(Regulation of Admission and Fixation of Fees) Act, 2007, Gujarat Act No. 3 of 2008

Government of Gujarat



વર્ગો માટેના પાત્રતા ધરાવતા) પ્રમાણપત્ર - ફક્ત ગુજરાત રાજ્ય ના અધિકારીઓ દ્વારા આપેલ હોય]

12. Copy of Passport (if Citizenship is Dual) [પાસપોર્ટની નકલ (જો નાગરિકતા ડ્યુઅલ હોય તો)]

13. Fitness Certificate (શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર)

14. Any other document as per requirement [જરૂરિયાત મુજબ અન્ય કોઈપણ દસ્તાવેજ]

- Candidates should bring envelope of 11 x 15-inch size. Write the following details on envelope with marker [ઉમેદવારોએ 11 x 15 ઇંચની કદનું પરબિડીયું લાવવાનું રહેશે. ઉમેદવારોએ પરબિડીયા પર નીચે મુજબની વિગતો માર્કર પેન વડે લખવાની રહેશે]:

Name of Candidate: (As per NEET-UG marksheet)			
User ID:		Category:	
General Merit No.:		NRI Merit No:	
Category Merit No.:		PwD Category Merit No.:	
Mobile No.:		(1)	(2)
E-mail id:			
Allotted Course in Present Round:			
Allotted Seat Category:			
Allotted Institute in Present Round:			
List of Document submitted: <i>(Please write Y/N in the box for relevant documents)</i>	1)	Allotment Letter of ACPUGMEC	
	2)	Tuition Fee Receipt	
	3)	Print Copy of NEET-UG Marksheet	
	4)	Std. 10 th Marksheet	
	5)	Std. 12 th Marksheet	
	6)	Proof of Date & Place of Birth & Indian Citizenship	
	7)	Domicile Certificate of Gujarat State	
	8)	Caste certificate	
	9)	Non-creamy layer certificate	
	10)	EWS Certificate	
	11)	Copy of Passport [if Citizenship is Dual/ Foreign]	
	12)	Fitness Certificate	
	13)		